

વર્ષ ૨૦૧૯-૨૦નાં વાર્ષિક કામગીરી મૂલ્યાંકન અહેવાલનાં વિવિધ તબક્કાઓ પૂર્ણ કરવા માટેની નિયત સમયમર્યાદા લંબાવવા બાબત.

ગુજરાત સરકાર

સામાન્ય વહીવટ વિભાગ

પરિપત્ર ક્રમાંક : ખહલ-૧૦૨૦૨૦-૨૪૯-ક

સચિવાલય, ગાંધીનગર.

તારીખ : ૧૧/૦૫/૨૦૨૦

સા. ટે. વિ.
રજીસ્ટ્રી

3-JUN-20

ઈનવર્ડ નં. 1298

વંચાણે લીધા :

- (૧) સા.વ.વિ.નો તા.૧૭/૪/૨૦૧૫નો ઠરાવ ક્રમાંક : ખહલ-૧૦-૨૦૧૫-૧૬૨-ક
- (૨) સા.વ.વિ.નો તા.૬/૧૧/૨૦૧૮નો ઠરાવ ક્રમાંક : ખહલ-૧૦-૨૦૧૫-૧૬૨-ક
- (૩) સા.વ.વિ.નો તા.૩૧/૦૩/૨૦૧૮નો ઠરાવ ક્રમાંક : ખહલ-૧૦-૨૦૧૮-૮૦૭૯૨-ક
- (૪) સા.વ.વિ.નો તા.૦૮/૦૩/૨૦૧૯નો ઠરાવ ક્રમાંક : ખહલ-૧૦-૨૦૧૯-૩૧૩૫૮-ક
- (૫) સા.વ.વિ.નો તા.૨૧/૦૩/૨૦૨૦નો પરિપત્ર ક્રમાંક : પરચ-૧૦૨૦૨૦-૫૦૧-ટ
- (૬) સા.વ.વિ.નો તા.૨૪/૦૩/૨૦૨૦નો પરિપત્ર ક્રમાંક : પરચ-૧૦૨૦૨૦-૫૦૧-ટ
- (૭) સા.વ.વિ.નો તા.૨૫/૦૩/૨૦૨૦નો પરિપત્ર ક્રમાંક : પરચ-૧૦૨૦૨૦-૫૦૧-ટ
- (૮) સા.વ.વિ.નો તા.૧/૦૪/૨૦૨૦નો પરિપત્ર ક્રમાંક : ખહલ-૧૦૨૦૨૦-૨૪૯-ક
- (૯) સા.વ.વિ.નો તા.૪/૦૫/૨૦૨૦નો પરિપત્ર ક્રમાંક : પરચ-૧૦૨૦૨૦-૫૦૧-ટ

પરિપત્ર

ઉક્ત વંચાણે લીધેલ ક્રમ (૧) થી (૪) પરના ઠરાવોથી રાજ્ય સરકારના વર્ગ-૧ થી વર્ગ-૩ સંવર્ગના અધિકારી/કર્મચારીઓના વાર્ષિક કામગીરી મૂલ્યાંકન અહેવાલ લખવા અંગેની સમય મર્યાદા નિયત કરવામાં આવેલ હતી. રાજ્યમાં ફેલાયેલ નોવેલ કોરોના વાયરસ (કોવિડ-૧૯)ના સંક્રમણને ધ્યાનમાં રાખીને સરકારી કચેરીઓ સીમિત સ્ટાફ સાથે ચાલુ રાખવા તેમજ ઉપરના વંચાણે લીધેલ ક્રમ (૫) (૬) (૭) અને (૯)ના પરિપત્રોથી કચેરીઓ બંધ રાખવાની સુચનાઓ પરિપત્રિત કરવામાં આવેલ છે.

સામાન્ય વહીવટ વિભાગના તા.૧/૦૪/૨૦૨૦ના પરિપત્રથી નિયત કરાયેલ નવી સમય-મર્યાદા અનુસાર સંબંધિત સંવર્ગ સંચાલકશ્રીઓ દ્વારા તેઓનાં તાબા હેઠળનાં અધિકારીઓ/કર્મચારીઓનાં PAR ફોર્મ તૈયાર કરી તમામ સંબંધિત અહેવાલ હેઠળનાં અધિકારીઓ / કર્મચારીઓને મોકલી આપવા શક્ય બનશે નહીં. જેના કારણે કામગીરી મૂલ્યાંકન અહેવાલ (PAR) નાં વિવિધ તબક્કાઓની કામગીરી પણ નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવી શક્ય બનશે નહીં.

૨. ઉક્ત બાબતને લક્ષમાં લેતાં તા.૧/૦૪/૨૦૨૦ના ઠરાવથી નિયત કરાયેલ સમય-મર્યાદા સંદર્ભે નીચે મુજબની સુધારેલ સુચનાઓ આથી પરિપત્રિત કરવામાં આવે છે.

(૧) રાજ્ય સરકારના વર્ગ-૧ અને વર્ગ-૨ સંવર્ગના અધિકારીઓના વર્ષ ૨૦૧૯-૨૦ના વાર્ષિક કામગીરી મૂલ્યાંકન અહેવાલના વિવિધ તબક્કાઓ પૂર્ણ કરવા માટેની નિયત સમયમર્યાદા આ સાથે સામેલ પત્રક-૧ મુજબ લંબાવવામાં આવે છે, અને રાજ્ય સરકારના સચિવાલય સંવર્ગના વર્ગ-૩ ના કર્મચારીઓના વર્ષ ૨૦૧૯-૨૦ના વાર્ષિક કામગીરી મૂલ્યાંકન અહેવાલના વિવિધ તબક્કાઓ પૂર્ણ કરવા માટેની નિયત સમયમર્યાદા આ સાથે સામેલ પત્રક-૨ મુજબ લંબાવવામાં આવે છે.


તેમજ રાજ્ય સરકારના વર્ગ-૩ સંવર્ગના (સચિવાલય સંવર્ગ સિવાયના) કર્મચારીઓના વર્ષ ૨૦૧૯-૨૦ના વાર્ષિક કામગીરી મૂલ્યાંકન અહેવાલનાં વિવિધ તબક્કાઓ પૂર્ણ કરવા માટેની નિયત સમયમર્યાદા આ સાથે સામેલ પત્રક-૩ મુજબ લંબાવવામાં આવે છે.

આ લંબાવેલ સમયમર્યાદા વર્ષ ૨૦૧૯-૨૦નાં વાર્ષિક કામગીરી મૂલ્યાંકન અહેવાલ સંદર્ભેની કામગીરી પુરતી જ મર્યાદિત રહેશે. વધુમાં, આ સંદર્ભેની સામાન્ય વહીવટ વિભાગની વખતોવખતની સુચનાઓ / જોગવાઈઓ યથાવત રહેશે.

(૨) તા.૨૯/૦૨/૨૦૨૦ થી તા.૩૧/૦૫/૨૦૨૦ દરમ્યાન વ્યવસ્થિત થયેલ અધિકારી/કર્મચારીઓએ તેમનાં 'SATHI' સોફ્ટવેર અંતર્ગત ભરવાના થતાં સ્વ મૂલ્યાંકન તા.૧૫/૦૭/૨૦૨૦ સુધીમાં ઓનલાઈન ભરવાના રહેશે, તેમજ જે અધિકારી / કર્મચારીઓએ 'SATHI' સોફ્ટવેર અંતર્ગત અહેવાલ લેખન કે સમીક્ષાની કામગીરી હાથ ધરવાની થતી હોય તો તેઓએ અહેવાલ લેખનની કામગીરી તા.૧૫/૦૮/૨૦૨૦ સુધીમાં અને સમીક્ષાની કામગીરી તા.૧૫/૦૯/૨૦૨૦ સુધીમાં ઓનલાઈન પૂર્ણ કરવાની રહેશે. આ હેતુ માટે આવા અધિકારી / કર્મચારીઓ 'SATHI' એપ્લિકેશનનો ઉપયોગ કરી શકશે.

(૩) વર્ષ ૨૦૧૯-૨૦ના વાર્ષિક કામગીરી મૂલ્યાંકન અહેવાલ માટે લંબાવવામાં આવેલ સમયમર્યાદામાં આ કામગીરી પૂર્ણ થાય તે અંગે દરેક અધિકારી / કર્મચારીઓએ અંગત કાળજી રાખવાની રહેશે.

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,


(એ. એચ. મનસુરી)

નાયબ સચિવ

સામાન્ય વહીવટ વિભાગ

ગુજરાત સરકાર

પ્રતિ,

- ❖ માન. રાજ્યપાલશ્રીના અગ્રસચિવશ્રી
- ❖ માન. મુખ્યમંત્રીશ્રીના અગ્રસચિવશ્રી
- ❖ માન. નાયબ મુખ્યમંત્રીશ્રીના અંગત સચિવશ્રી
- ❖ માન. મંત્રીશ્રી/રા.ક.મંત્રીશ્રીઓના અંગત સચિવશ્રીઓ
- ❖ માન. વિરોધપક્ષના નેતાશ્રીના અંગત સચિવશ્રી
- ❖ મુખ્ય સચિવશ્રીના નાયબ સચિવશ્રી, સચિવાલય, ગાંધીનગર
- સચિવશ્રી, ગુજરાત જાહેર સેવા આયોગ, અમદાવાદ
- સચિવશ્રી, ગુજરાત વિધાનસભા સચિવાલય, ગાંધીનગર
- સચિવશ્રી, ગુજરાત તકેદારી આયોગ, ગાંધીનગર
- સચિવશ્રી, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર
- સચિવશ્રી, ગુજરાત મુલ્કી સેવા ટ્રિબ્યુનલ, ગાંધીનગર
- સચિવશ્રી, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર
- રજીસ્ટ્રારશ્રી, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદ
- ❖ ખાસ ફરજ પરનાં અધિકારીશ્રી, એચ.આર.એમ.એસ. સેલ, સામાન્ય વહીવટ વિભાગ, ગાંધીનગર તરફ જરૂરી જાણ તથા 'SATHI' સોફ્ટવેર અંતર્ગત આ સુચનાઓની અમલવારી કરાવવા અંગે તેમજ આ પરિપત્ર 'SATHI' પોર્ટલ પર તાત્કાલિક પ્રસિદ્ધ કરવા અંગે યોગ્ય કાર્યવાહી કરવા સારુ.
- ❖ સીસ્ટમ મેનેજરશ્રી, કોમ્પ્યુટર સેલ, સામાન્ય વહીવટ વિભાગ, સચિવાલય, ગાંધીનગર તરફ GSWAN પર સા.વ.વિ./ક-શાખાનાં પરિપત્ર સંગ્રહમાં આ પરિપત્ર અપલોડ કરવા જરૂરી કાર્યવાહી કરવા સારુ.
- ❖ એકાઉન્ટન્ટ જનરલશ્રી, ગુજરાત રાજ્ય, અમદાવાદ
- ❖ એડીશનલ એકાઉન્ટન્ટ જનરલશ્રી, ગુજરાત રાજ્ય, અમદાવાદ/ગાંધીનગર
- ❖ સામાન્ય વહીવટ વિભાગના સર્વે અધિકારીઓ/સર્વે શાખાઓ
- ❖ પગાર અને હિસાબી અધિકારીશ્રી, અમદાવાદ/ગાંધીનગર
- ❖ રેસીડેન્ટ ઓડીટ ઓફીસરશ્રી, અમદાવાદ/ગાંધીનગર
- ❖ ડાયરેક્ટર જનરલશ્રી, સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા, અમદાવાદ-૧૫
- ❖ માહિતી નિયામકશ્રી, ગાંધીનગર - જાહેર પ્રસિદ્ધિ અર્થે
- ❖ સચિવાલયના સર્વે વિભાગો
- ❖ સર્વે ખાતાના વડાઓ (ખાતાના વડા હેઠળની કચેરીઓને ઉક્ત સૂચનાઓ મોકલવાની વિનંતી સાથે)
- ❖ રાજ્ય સરકારના સર્વે બોર્ડ / કોર્પોરેશન.
- ❖ એક્ઝીક્યુટીવ, સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ, GSWAN ઉપર પ્રસિદ્ધિ અર્થે.
- ❖ નાયબ સેક્શન અધિકારી સિલેક્ટ ફાઇલ
- ❖ સિલેક્ટ ફાઇલ.

➤ પત્ર દ્વારા.